

યુનિટ - ૧

પ્રશ્ન: નીચે આપેલા પેરા પુણોના અંગ્રેજી વધુ જવાબો આપ્યા છે. સાચો પિલ્લુ પસંદ કરો.

(૧) જાનીનગરીનાનો આખર રરકિંગ મૂલ્યાંકન

(૧) રંમેશા હરીદ કિનને ચાપ છે.

(૨) રંમેશા બજાર કિનને ચાપ છે.

(૩) હરીદ કિન કે બજાર કિન જે કોઈની રપિ ને કિનને ચાપ છે.

(૨) જાનીનગરીનાનો બાજ-બાદ હરીદ પેસાણામાં :

(૧) બાજની ગાહાગરી હરીદની નારીખયા રપે પછીની નારીખ સુધી ચાપ છે.

(૨) બાજની પાછલી નારીખયા હરીદની નારીખ સુધી ચાપ છે.

(૩) બાજની ગાહાગરી ચાલી નથી.

(૩) જાનીનગરી પર બાજની ગાહાગરી :

(૧) નેની દાર્શનિક કિન પર ચાપ છે.

(૨) નેની બજાર કિન પર ચાપ છે.

(૩) નેની હરીદ-કિન પર ચાપ છે.

(૪) બાજ-સારિન હરીદ માટે મૂડી કિન કોલે.

(૧) જેટલા નાણા દલાલને હરીદકિન પેટે મૂક્યા રોપ ને

(૨) હરીદ કિન - સમાપેલ બાજ + દલાલ

(૩) હરીદ નારીખે બજાર કિન રોપ ને.

(૪) હરીદ કિન + સમાપેલ બાજ - દલાલ

(૫) રમેશ રોકાણકારે તા. ૧-૬-૨૦૦૬ના રોજ ~~રૂ. ૯૧.૦૦~~ની સારા સરકારની રૂ. ૬૦.૦૦૦ની લાભે ૧૦૨% વ્યાજ સરિત લાવે ખરીદી. દલાલી સોદા પ્રિમન પર ૧% લેખે મૂકવી. વ્યાજ ૩૦ની ડિસેમ્બર અને ૩૧ની માર્ચના રોજ મૂકવાય છે. તો રોકાણની મૂડીપ્રિમી નીચે મુજબ રશે.

(i) ૬૦૬૬૦ (ii) ૫૦૬૬૦ (iii) ૫૧.૦૦૦ (iv) ૫૦૬૫૦.

(૬) શ્રી પ્રદેવ પાસે તા. ૧-૧-૨૦૦૬ના રોજ રૂ. ૧,૦૦,૦૦૦ના ૧૦%ના ડિવિડેન્ડ દલા. તેણે ૧૫-૪-૨૦૦૬ના રોજ આ પૈકી રૂ. ૨૦,૦૦૦ના ડિવિડેન્ડ વ્યાજસરિત ૯૬% લેખે લેરવા. વાર પછી તેણે રૂ. ૪૦,૦૦૦ના ડિવિડેન્ડ ૧૦૨%ના લાભે તા. ૧૫-૬-૨૦૦૬ના રોજ વ્યાજબાદ લાવે ખરીદી. વ્યાજ ૩૦ની જૂન અને ૩૧ની ડિસેમ્બરના રોજ મૂકવાય છે. તો તેને ૩૦-૬-૨૦૦૬ના રોજ નીચે મુજબ વ્યાજ મળ્યું રશે.

(i) રૂ. ૪૦૦૦ (ii) રૂ. ૫૦૦૦ (iii) રૂ. ૬૦૦૦ (iv) રૂ. ૩૨૦૦.

(૭) શ્રી રમેશ પાસે તા. ૧-૪-૨૦૦૫ના રોજ રૂ. ૧,૦૦,૦૦૦ની દાર્શનિક પ્રિમીની સરકારી અમીનગીરી રતી. જેની મૂડીપ્રિમી રૂ. ૯૯-૨૫૦ રતી. તા. ૧-૬-૨૦૦૫ના રોજ તેણે બીજા રૂ. ૩૦,૦૦૦ની અમીનગીરી ૧૦૧%ના વ્યાજસરિત લાવે ખરીદી. આ પૈકી તા. ૧-૧૧-૨૦૦૫ના રોજ તેણે રૂ. ૪૦,૦૦૦ની અમીનગીરી લાવેલા વ્યાજ-બાદ લાવે લેવી તા. ૩૧-૩-૨૦૦૬ના રોજ તેણે પાસે નીચેની મૂડીપ્રિમીની અમીનગીરી રશે. (ફિક્સે પદ્ધતિ પ્રમાણે) વ્યાજની તારીખો ૩૦-જાન્યૂન અને ૩૧-ડિસેમ્બર

(i) ૯૯,૩૫૦ (ii) ૯૦,૦૦૦ (iii) ૯૦,૧૦૦ (iv) ૯૦,૩૫૦.

(૮) ઇન્વેસ્ટર પાસે ૧% અન્ટ્યુ ૨૦૦૬ના રોજ રૂ. ૧,૫૦,૦૦૦ની ૧૨%ની ગુજરાત સરકારની અમીનગીરીઓ રતી. જેના સોપડે પ્રિમન રૂ. ૧,૪૪,૦૦૦ રતી. વ્યાજ દર લેખે ૩૧ની માર્ચ અને ૩૦ની, સપ્ટે. ના રોજ મૂકવાય છે. ખરીદ-લેવાણના દરેક વ્યવહાર પર ૧% લેખે દલાલી દાર્શનિક પ્રિમન પર ગણાવી રાખે તો દલાલીની રકમ નીચે મુજબ ગણાવે રશે.

(i) શૂન્ય (ii) ૧,૫૦૦ (iii) ૧૪૪૦ (iv) આ પૈકી કોઈ પણ નથી.

યુનિટ-૨

પ્રશ્ન: નીચે દર્શાવેલ દરેક પ્રશ્નના સંગે સાપેક્ષ પિચ્છપોમાંથી સાચો પિચ્છ પસંદ કરો:

(૧) રાશી સંગ્રહ :

- (અ) સ-પેરિયોડ આગીદારી (બ) કામચલાઉ આગીદારી
(ક) મર્યાદિત આગીદારી (ડ) સારસિક વેપારીનું કાયમી જૂથ.

(૨) નીચે દર્શાવેલ ખાતા પૈકી કયું ખાતું દિનોંદી નામાવધાન સાથે સંકલ્પાયેલ નથી ?

- (અ) રાશી ખાતું
(બ) સત્ત્વ આગીદાર સાથેનું રાશી ખાતું
(ક) કાયું રાશી ખાતું
(ડ) સંયુક્ત બેંક ખાતું

(૩) રાશી ખાતાની બેંક :

- (અ) રાશી ખાતાની ઉદ્યોગબાજુ દર્શાવાય.
(બ) સરઆગીદારના ખાતાની જમા બાજુ દર્શાવાય.
(ક) રાશી ખાતાની જમા બાજુ દર્શાવાય.
(ડ) સંયુક્ત બેંક ખાતાની ઉદ્યોગબાજુ દર્શાવાય.

(૪) રાશી ખાતું સંગ્રહ :

- (અ) માલ-મિલકતનું ખાતું
(બ) ક્રીપ્સ બચતનું ખાતું
(ક) વ્યાજનું ખાતું
(ડ) ઉપલક્ષ ખાતું

(૫) રાશના ઇંધામાં થયેલ અસામાન્ય ગુમ્સાન નીચેના ખાતે ઉધાર થાય:

- (i) રાશ ખાતે (ii) બીમા ડ્રાવની ખાતે
(iii) સામાન્ય ગમ્સાન ગુમ્સાન ખાતે (iv) કોઇ ખાતે નરિ.

(૬) જૂની મોટરકાર લેમવાના રાશના ઇંધામાં એક મોટરકાર કોઇ ગ્રાહકને બકિસ આપવામાં આવે તો તે નીચેના ખાતે ઉધાર થાય:

- (i) રાશ ખાતે (ii) ~~બીમા ડ્રાવની~~ ગમ્સાન ગુમ્સાન ખાતે
(iii) અસામાન્ય ગુમ્સાન ખાતે (iv) કોઇ ખાતે નરિ.

(૭) રાશના ઇંધામાં વેચાણ બદલ રૂ. ૩૦૦.૦૦૦ ના બોન્ડ મળ્યા અને રૂ. ૩૨૫.૦૦૦માં તે વેચી દીધા રહે તો રાશ ખાતે જમા બાજુ રૂ. ----- ની નોંધ થાય.

- (i) રૂ. ૨૫.૦૦૦ (ii) રૂ. ૩૨૫.૦૦૦ (iii) રૂ. ૩૦૦.૦૦૦ (iv) રૂ. ૫૨૫.૦૦૦

(૮) રાશના ઇંધામાં વેચાણ બદલ રૂ. ૫૦૦.૦૦૦ ના બોન્ડ મળ્યા અને તે રૂ. ૪૭૫.૦૦૦ માં વેચી દીધા તો રાશ ખાતે ની ઉધાર બાજુ રૂ. ----- ની નોંધ થાય.

- (i) રૂ. ૫૦૦.૦૦૦ (ii) રૂ. ૪૭૫.૦૦૦ (iii) રૂ. ૧૨૫.૦૦૦ (iv) રૂ. ૧૦૭૫.૦૦૦

(૯) જ્યારે રાશના ઇંધામાં સ્વતંત્ર રિસાબી સોપડા રાખવામાં આવતા રહે ત્યારે રાશ માટે મુખ્યાયેલ ખર્ચ-

- (i) સંપૂર્ણ બેન્ડ ખાતે જમા થાય છે.
(ii) સંપૂર્ણ બેન્ડ ખાતે ઉધાર થાય છે.
(iii) મુખ્યત્વે લાગીદાર ખાતે ઉધાર થાય છે.
(iv) રાશ ખાતે જમા થાય છે.

(૧૦) K અને R સંપૂર્ણ સારસમાં ઇંધો છે અને બેને રાશના રિસાબી રાખે છે. K એ ફેરલોક માલ ઉધાર લેયેલ તેમાંથી ફેરલોક સ્થમની દાલખાદ પડી. જાર(R) પોતાના સોપડામાં આ દાલખાદ સંગ્રહિત કરી ખાતે ઉધાર કરશે ?

- (i) K નું ખાતે (ii) રાશ ખાતે (iii) ફેરલોક ખાતે (iv) દેવાદારનું ખાતે

પ્રશ્ન.૧ : નીચે આપેલા પેરા પૂર્ણોત્તર એકથી વધુ જવાબો આપ્યા છે,
આચો વિચલન પ્રસંદ કરો :

- (૧) એ વેટસ્વરૂપે બરીદી-વચોદાના હિસાબો લખવા હોય તો
(i) ફક્ત only Accounts માં જવું (ii) Only Inventory માં જવું
(iii) Accounts-with-Inv માં જવું (iv) ઉપરમાંથી એકેમાં નહિ જવું.
- (૨) ટેબલ ૭.૨ માં નીચેના કારણો અમાન નથી :
(i) માફ્ટ સરવૈયું (ii) ગુણોત્તર વિશ્લેષણ
(iii) વેર કોમ્પ્યુટેશન (iv) એલ્સ ટ્રેડિંગ તિમાસિક રિપોર્ટ
- (૩) ટેબલમાં એ સામગ્રી ઉમેરી હોય તો નીચેની કી દર્શાવવી.
(i) F5 (ii) F6 (iii) F7 (iv) F8.
- (૪) ટેબલમાં બધા વ્યવહારોની નોંધ થઈ ગયા પછી નીચેનું પત્રક
બતાવવું પડે :
(i) Trial Balance (ii) Profit and Loss A/c
(iii) Balance Sheet (iv) ઉપરમાંથી એકે નહિ.
- (૫) ટેબલને ઉપયોગ કરવા સૌથી પહેલાં
(i) Ledger Creation માં જવું (ii) Company Creation માં જવું
(iii) Accounting Voucher માં જવું (iv) Inventory Info માં જવું
- (૬) ટેબલના હિસાબોમાં એ રીકૉર્ડની સૂચવણની સામગ્રી ઉમેરી હોય તો
નીચેની કી દર્શાવવી :
(i) F7 (ii) F6 (iii) F8 (iv) F5.
- (૭) ટેબલના હિસાબોમાં તારીખ બદલવા નીચેની કી દર્શાવવી
(i) F11 (ii) F5 (iii) F6 (iv) F2.
- (૮) એ B/S અને P&L ની ભગવતાર આરમી એકથી હોય તો નીચેની કી દર્શાવવી.
(i) F11 (ii) Ctrl + F2 (iii) Alt + F1 (iv) F12.

(૫)

ટુમર ૪

પ્રશ્ન:૧ ખાલી જગ્યા પૂરો.

(૧) ભાડે ખરીદ પદ્ધતિની ખરીદાયેલી મિલકતની ----- કિંમત
પર ધસારો ગણવામાં આવે છે.

(૨) ભાડે ખરીદ પદ્ધતિ અનુસાર મિલકત ખાતું ----- કિંમતની
હિસાબમાં આવે છે, અને વ્યાજની રકમ ----- ખાતે
હિસાબમાં આવે છે.

(૩) વસ્તુની કુલ કિંમત બાદ રોકડ કિંમત બરાબર ----- .

પ્રશ્ન:૨ નીચેના વિધાનો ખરાં છે કે ખોટા જણાવો.

(૧) ભાડા ખરીદ પદ્ધતિમાં વસ્તુ ખરીદવાનો કુલ ચાલુ છે ~~ભાડા~~
તરત જ મિલકતનો માલિકી આ ખરીદનારને મળી જાય છે.

(૨) ભાડા ખરીદ પદ્ધતિ અનુસાર જેલની રકમ રોકડ કિંમત પો
મૂંઝી રોય તેના પર ધસારો ગણાય છે.

(૩) ભાડે ખરીદ પદ્ધતિ અને રૂપા પદ્ધતિની મુખ્યત્વે - એમ બંને
વિધાનો દિશાબદ્ધે મારે એક જ વસ્તુ છે.

પ્રશ્ન:૩ નીચેના પૈકી કયું વિધાન સાચું છે. ૩.

(૧) ભાડે ખરીદ પદ્ધતિની ખરીદાયેલ મિલકતની રોકડ કિંમત પર
ધસારો ગણવામાં આવે છે.

(૨) ભાડે ખરીદ પદ્ધતિની ખરીદાયેલ મિલકતની કુલ કિંમત પર
ધસારો ગણવામાં આવે છે.

(૩) ભાડે ખરીદ પદ્ધતિની ખરીદાયેલ મિલકતની વનર કિંમત પર
ધસારો ગણવામાં આવે છે.

પ્રશ્ન:૪ નીચેના પૈકી કયું વિધાન સાચું છે. ૪

(૧) ભાડે-ખરીદ પદ્ધતિમાં વ્યાજ દરેક રૂપા વખતે કુલ કિંમત
પર ગણવામાં આવે છે.

(૨) ભાડે-ખરીદ પદ્ધતિમાં વ્યાજ દરેક રૂપા વખતે રોકડ કિંમતની
બાકી રકમ પર ગણાય છે.

(૩) ભાડે ખરીદ પદ્ધતિમાં વ્યાજ દરેક રૂપા વખતે મિલકતની શરૂઆતની
બાકી પર ગણાય છે.

પ્રશ્ન: ૫: જીલ્લાના ટોચ-પ્રજાનો જવાબ આપે એકથી વધુ વિધાનો
આપેલા છે, તેમાંથી સાચો વિધાન પસંદ કરો :

(૧) વડોદરા ક્ષેત્ર કોંગ્રેસ બેઠક બેઠક બેઠક -

- (૧) કોંગ્રેસ કોંગ્રેસ (૨) કોંગ્રેસ
(૩) કોંગ્રેસ કોંગ્રેસ (૪) કોંગ્રેસ કોંગ્રેસ

(૨) મહાનગર કોંગ્રેસ કોંગ્રેસ + બેઠક = _____ કોંગ્રેસ.

- (૧) કોંગ્રેસ કોંગ્રેસ (૨) કોંગ્રેસ કોંગ્રેસ
(૩) કોંગ્રેસ કોંગ્રેસ (૪) કોંગ્રેસ કોંગ્રેસ

(૩) આજે કોંગ્રેસ પસંદગી અંગત બેઠકની રકમ - _____ બેઠક
કોંગ્રેસમાં આપે છે.

- (૧) કોંગ્રેસ (૨) કોંગ્રેસ
(૩) મહાનગર (૪) કોંગ્રેસ.

(૪) જો વડોદરા કોંગ્રેસ કોંગ્રેસ બેઠક કોંગ્રેસની રકમ
_____ બેઠક બેઠક આપે છે.

- (૧) કોંગ્રેસ (૨) મહાનગર
(૩) કોંગ્રેસ (૪) કોંગ્રેસ

(૫) કોંગ્રેસ બેઠક ૩, ૨૪૦૦ મુજબ બેઠકની જો વડોદરા ૧૦%
(૩ ૨૮૦૦)

કોંગ્રેસ બેઠક અંગત ૩, ૩૧૦ ૩, ૨૮૦, ૩, ૧૮૦
કોંગ્રેસ ૩, ૧૩૨૦ મુજબ કોંગ્રેસ કોંગ્રેસ

- (૧) ૩, ૮૮૦ (૨) ૩, ૧૦, ૦૦૦
(૩) ૩, ૧૧, ૭૦૦ (૪) ૩, ૧૨, ૦૦૦

~~~~~

જવાબો ~ દ્વિતીયો નામાપદ્યાન - ૨  
ચુનિટ-૧ [ C C 108 ]  
 સોમેસર - ૨

|         |         |
|---------|---------|
| ૧ = (૩) | ૬ = (૩) |
| ૨ = (૨) | ૭ = (૧) |
| ૩ = (૧) | ૮ = (૨) |
| ૪ = (૨) |         |
| ૫ = (૨) |         |

ચુનિટ-૨

|         |          |
|---------|----------|
| ૧ = (૪) | ૬ = (૪)  |
| ૨ = (૬) | ૭ = (૧)  |
| ૩ = (૬) | ૮ = (૩)  |
| ૪ = (૪) | ૯ = (૧)  |
| ૫ = (૪) | ૧૦ = (૨) |

ચુનિટ-૩

|         |         |
|---------|---------|
| ૧ = (૩) | ૫ = (૨) |
| ૨ = (૪) | ૬ = (૪) |
| ૩ = (૩) | ૭ = (૪) |
| ૪ = (૪) | ૮ = (૩) |

ચુનિટ-૪

પ્રશ્ન-૧ (i) રોડ કિમી (ii) રોડ કિમી નાં બાજુ  
 (iii) જાણ

પ્રશ્ન-૨ (૧) ખોટું (૨) ખોટું (૩) ખોટું

( P.T.O. )



ଗୃହ  
ସମସ୍ତ

ଜିନିଷ ନାମ ପଞ୍ଜିକା-୧  
[ C.C. 108 ]  
ଅକ୍ଷର ୧ = ୧

ପ୍ରଥମ : ୩ = (୧)

ପ୍ରଥମ : ୪ = (୧)

ପ୍ରଥମ : ୫

୧ = (୧)

୪ = (୧)

୨ = (୧)

୫ = (୧)

୩ = (୩)

~~~~~